



**BCG-002-001502**

Seat No. \_\_\_\_\_

**B.Com (Sem. V) (CBCS) Examination**

**August - 2021**

**Fundamentals of Statistics-1**

*(Old Course)*

**Faculty Code : 002**

**Subject Code : 001502**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- સ્વીચ્છા :** (1) બધા પ્રશ્નનો ફરજિયાત છે.  
 (2) જમણી બાજુએ ગુણ દર્શાવેલ છે.

- 1** (A) સ્પષ્ટરમેનની કમાંક સહસંબંધાકની રીત સમજાવો. [10]  
 (B) નીચેની માહિતી પરથી કાર્લપિયરસનની રીત સહસંબંધાક શોધો.

$x$	5	6	8	9	12
$y$	3	5	8	9	10

**અથવા**

- 1** (A) સહસંબંધાક એટલે શું ? તેના પ્રકાર સમજાવો.  
 (B) નીચેની માહિતી પરથી કમાંક સહસંબંધાક શોધો.

$x$	11	16	13	18	12	15	14	17	19
$y$	24	25	26	27	21	23	22	28	29

- 2** (A) નિયત સંબંધાકોનો ગુણાધર્મો જણાવો.  
 (B) નીચેની માહિતી પરથી બંને નિયત સંબંધ સમીક્ષણ મેળવો.

$$\bar{x} = 12, \quad \bar{y} = 5, \quad \sigma_x = 8, \quad \sigma_y = 2, \quad r = 0.8$$

**અથવા**

- 2** (A) સહસંબંધ અને નિયતસંબંધ વચ્ચેનો તફાવત સમજાવો.  
 (B) બે નિયતસંબંધ રેખાઓ  $4x - 5y + 33 = 0$  અને  
 $20x - 9y - 107 = 0$  હોય તો  $\bar{x}, \bar{y}$  અને  $r$  શોધો.

3 (A) સાબિત કરો કે : [7]

$$P(A \cup B) = P(A) + P(B) - P(A \cap B)$$

(B) જે  $P(A) = 0.6$ ,  $P(B) = 0.5$  અને  $P(A \cup B) = 0.8$

હોય તો,  $P(A' \cap B')$ ,  $P(A' \cap B')$  અને  $P(A/B)$ . શોધો

**અથવા**

3 (A) યદશ્રી ચલ  $x$ નું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે. [15]

$x$	0	1	2	3	4
$p(x)$	$k$	0.25	$3k$	0.25	0.10

Find : (i) K (ii) E (x) (iii) V (x)

4 (A) દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો. [7]

(B) દ્વિપદી વિતરણમાં  $n = 4$ ,  $P(x=1) = P(x=2)$ .  
હોય તો  $P(x=0)$  શોધો.

**અથવા**

4 (A) પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો જણાવો. [7]

(B) એક પ્રામાણ્ય વિતરણ માટે  $Q_1 = 73$  અને  $M = 83$   
હોય તો ચતુર્થક વિચલન, પ્રમાણિત વિચલન અને સરેરાશ  
વિચલન શોધો.

## ENGLISH VERSION

**Instruction :**

- (1) All questions are compulsory.
- (2) Marks are indicated on right side.

1 (a) Explain Spearman's Rank correlation coefficient [10]  
method.

(b) Find out the Karl Pearson's correlation coefficient [10]  
from the following data.

$x$	5	6	8	9	12
$y$	3	5	8	9	10

**OR**

- (a) What is correlation ? Explain its types. [10]  
 (b) For given data find rank correlation coefficient. [10]

$x$	11	16	13	18	12	15	14	17	19
$y$	24	25	26	27	21	23	22	28	29

- 2 (a) State the properties of regression coefficient. [10]  
 (b) For the given data obtain both the regression equations.

$$\bar{x} = 12, \quad \bar{y} = 5, \quad \sigma_x = 8, \quad \sigma_y = 2, \quad r = 0.8$$

**OR**

- (a) Explain the difference between Correlation and Regression. [10]  
 (b)  $4x - 5y + 33 = 0$  and  $20x - 9y - 107 = 0$  are the two regression lines. Find  $\bar{x}$ ,  $\bar{y}$  and  $r$ . [10]

- 3 (a) Prove that : [7]

$$P(A \cup B) = P(A) + P(B) - P(A \cap B)$$

- (b) If  $P(A) = 0.6$ ,  $P(B) = 0.5$  and  $P(A \cup B) = 0.8$  then find  $P(A \cap B)$ ,  $P(A' \cap B')$  and  $P(A/B)$ .

**OR**

- (A) r.v.  $x$  has the following prob. distribution. [15]

$x$	0	1	2	3	4
$p(x)$	$k$	0.25	$3k$	0.25	0.10

Find (i)  $K$  (ii)  $E(x)$  (iii)  $V(x)$

- 4 (a) State the properties of binomial distribution. [7]  
 (b) For a binomial distribution  $n = 4$ ,  $P(x=1) = P(x=2)$ . Find  $P(x=0)$ . [8]

**OR**

- (a) State the properties of normal distribution. [7]  
 (b) For a normal distribution  $Q_1 = 73$  and  $M = 83$  then find quartile deviation, standard deviation and mean deviation. [8]